

આળસ

LAZINESS, IDLENESS, LETHARGY

વાંચકો માટે ખાસ નોંધ :

- આ કિતાબને પરીપૂર્ણ બનાવવા આપના સૂચનો hadi1981@ymail.com ઉપર મોકલી આપો.

બિસમીલ્હાહી રહમા નિર્હીમ

અનુક્રમણિકા

પ્રકરણ	પેજ
૧. આળસના નુકસાન	૦૩
૨. આળસની નિશાની	૦૪
૩. આળસનો ઉપાય	૦૪
૪. મહેનતનું મહત્વ અને ફાયદા	૦૪
૫. ઘરકામ એ રચનાત્મક વ્યાયામ છે	૦૪
૬. હલાલ રોગી માટે મહેનત કરવી	૦૬
૭. કામ પ્રત્યે બદલાયેલું લોકવલણ	૦૬
૮. સ્ત્રીઓ અને આળસ	૦૭
૯. નિવૃત જીવન (રીટાર્ડ લાઈફ)	૦૮

૧. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :
આળસુ દીન અને દુનિયાને નુકસાન પહોંચાડે છે.
૨. ઈમામ અલી ઈજ્ઝે અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :
તમારા કાર્યોમાં કદ્દી આળસુ ઉપર ભરોસો ન કરશો.
(તે કામ કરવામાં વિલંબ કરશો, અથવા આણસના કારણે નહિં કરે, તેથી કામ બગડી શકે છે)
૩. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :
આણસ કામનો દુષ્મન છે.
૪. ઈમામ અલી ઈજ્ઝે અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :
આણસ આખેરતને ખરાબ કરી નાખે છે.
૫. ઈમામ અલી ઈજ્ઝે અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :
આણસ સર્જણતાની આઈત છે.
૬. ઈમામ અલી ઈજ્ઝે અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :
ઢીલ કરવી / મુલતવી રાખવું મહેરુમી (વંચિતપણા)નું કારણ છે.

૧. મીઝાનુલ હિકમત, ઉર્દુ, ભાગ : ૮, પેજ : ૬૩૪, હદીસ : ૧૭૩૫૦
૨. મીઝાનુલ હિકમત, ઉર્દુ, ભાગ : ૮, પેજ : ૬૩૬, હદીસ : ૧૭૩૫૮
૩. મીઝાનુલ હિકમત, ઉર્દુ, ભાગ : ૮, પેજ : ૬૩૬, હદીસ : ૧૭૩૬૧
૪. મીઝાનુલ હિકમત, ઉર્દુ, ભાગ : ૮, પેજ : ૬૩૬, ૬૩૭, હદીસ : ૧૭૩૬૨
૫. મીઝાનુલ હિકમત, ઉર્દુ, ભાગ : ૮, પેજ : ૬૩૫, હદીસ : ૧૭૩૫૨
૬. તજલીયાતે હિકમત, ઉર્દુ, પ્રકરણ : ૫૮, હીરમાન, હદીસ : ૨, પેજ : ૧૩૪

૨. આળસની નિશાની

૧. ઈમામ અલી ઈજને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

કાર્ય કરવામાં વિલંબ કરવો એ આળસની પ્રસ્તાવના છે.

૧. મીજાનુલ હિક્મત, ઉર્દુ, ભાગ : ૮, પેજ : ૬૩૬, ૬૩૭, હદીસ : ૧૭૩૮૫

૩. આળસનો ઉપાય

૧. ઈમામ અલી ઈજને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

‘રગબત’ તનતોડ મહેનત (ભારે પરિશ્રમ)ની ચાવી છે અને ‘ઈખ્ર્ઝ’ થકાવટ (મજૂરીકામ)ની સવારી છે.

- રગબત : ઝંખના, કામના, અભીષ્ટા, આતુરતા, ઈઞ્ચા, વાસના, આકંક્ષા, અભરખો, મનોકામના, વલણ, વળાંક, રૂચિ, રસ, શોખ

૧. તજલીયાતે હિક્મત, ઉર્દુ, પેજ : ૧૩૮, પ્રકરણ : ૬૩, હદીસ : ૨૫

જે લોકો મહેનત અને પરિશ્રમનું મૂલ્ય સમજે છે, તેઓ ખંતીલા અને ઉમંગવાળા હોય છે. માટે તેઓ તંદુરસ્ત પણ હોય છે. જે લોકો રચનાત્મક પરિશ્રમના કાર્યો નથી કરતા, તેઓ શરીરથી નબળાં અને માંદલાં રહે છે. તેઓ પૂરતો વ્યાયામ કામ મારફતે કરતાં નથી તેથી તેઓને વ્યાયામ માટે ખાસ સમય કાઢવો પડે છે. તેથી જ કહેવાયું છે કે નાનાંમોટાં કામ કરો અને તાજગીસભર રહો.

કામ કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે. નિયમિત અને નિયમસર કામ કરવાથી સુદૃઢ બનેલા શરીરમાં રોગો ઓછાં આવે છે. રોગ સામે પ્રતિકારક કરવાની ક્ષમતા જન્મે છે. પાચન માટેનો અજીન સતેજ થાય છે, સમયસર ભૂખ લાગે છે, શારીરિક સ્ફૂર્તિ અને શક્તિમાં વધારો થાય છે, શરીર કસાયેલું અને ઘાટીલું બને છે, નબળાઈ અને આણસ દૂર થાય છે તથા રૂતુઓની ઉલ્ટી અસર થતી નથી. આ ઉપરાંત અન્ય આર્થિક ફાયદા તો ખરા જ.

કામ ન કરનાર અથવા તો જરૂરિયાત કરતાં ઓછો શારીરિક શ્રમ કરનાર માણસ આગસુ થઈ જાય છે. તેની ઉધનું પ્રમાણ વધી જાય છે. વજન વધી જાય છે. શરીર બેડોળ બની જાય છે. ચામડીના કે આંતરડાંના અને મૂત્રાશયના રોગો પણ શરૂ થાય છે.

૫. ધરકામ એ રચનાત્મક વ્યાયામ છે

ધરકામ એ ખરા અર્થમાં રચનાત્મક વ્યાયામ (કસરત) છે, કારણ કે ધરકામ કરવાથી કસરતની સાથે માણસને પોતાને તો ફાયદો થાય જ છે, કુટુંબ અને સમાજને પણ લાભ થાય છે. નાનાંમોટાં ધરકામમાં માતાપિતા કે ભાઈબહેનને મદદરૂપ થવું જોઈએ. સામૂહિક શ્રમ એ શ્રમની યોગ્ય વહેંચણી છે. એમ કરવાથી કુટુંબના એક સત્ય ઉપર બધો બોજ નથી પડતો. ધરના કામમાં આપણાને કોઈ શરમ કે સંકોચ થવો ન જોઈએ. આપણું કામ તો આપણે કરવાનું જ છે, પરંતુ કુટુંબના અન્ય સત્યોના કામમાં આપણે સહાયરૂપ થવાનું છે. નાનાં બાળકો ધરના આંગણામાં બનાવેલા નાનકડા બગીચામાં સાફસફાઈ કે છોડને પાણી પાંચું, નાની મોટી ચીજો બજારમાંથી લાવી આપવી વગેરે કામો કરે, તો તે ઉપયોગી શ્રમ બને છે. તેવી જ રીતે પોતાનાં કપડાં જાતે ઘોવા, ઘોયેલા સ્વચ્છ કપડાને યોગ્ય રીતે ગડી વાળી ગોઠવવા, જમવા બેસતી વખતે વાસણ, પાણી કે સુફરાની વ્યવસ્થા જાતે કરવી, પોતાની પથારી જાતે પાથરવી અને સંકેલવી વગેરે દ્રષ્ટાંતરૂપ રચનાત્મક ધરકામો છે.

૬. હલાલ રોજી માટે મહેનત કરવી

ઈસ્લામમાં જે ચીજોની ‘ઈબાદત’ તરીકે ઓળખ આપવામાં આવી છે તેમાંની એક ‘હલાલ રોજી’ પણ છે, ઉપરાંત બીજા પાસે હાથ લંબાવવો ન પડે એ નિયતથી રોજી મેળવવા માટેના પ્રયત્નને પણ ઈબાદતમાં ગણવામાં આવે છે. આ બાબતનું મહત્વ દર્શાવતી અસંખ્ય હદ્દીસો અને રિવાયતો જોવા મળે છે, પરંતુ એ સ્પષ્ટ હોવું જોઈએ કે અહીં બધા કામ ઈબાદતમાં નહીં ગણાય પણ રોજી મેળવવા માટે અને જુંગાની આજીવીકા એકઠી કરવા માટે કામ કરવામાં આવે, તો તે અલ્લાહની નજરમાં ઈબાદતનું સ્થાન પામશે. અને એ પણ ઘાનમાં રાખવું જોઈએ કે કામ-કાજ કર્યા વગરની ‘ઈબાદત’ કોઈ મહત્વ અને સ્થાન ઘરાવતી નથી કારણે કે ઈન્સાનની આર્થિક હાલત તંદુરસ્ત હોવી જોઈએ જેથી કરીને તે ખુલુસ અને મઅરેફતની સાથે અલ્લાહની ઈબાદત કરી શકે.

અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદ મુસ્તફા(સ. અ. વ.)ની સામે એક એવા શાખસનો ઉલ્લેખ કરવામાં આવ્યો જે ઝોહદ અને તકવા માટે પ્રખ્યાત હતો અને કાયમ નમાજ અને રોજામાં વસ્ત રહેતો હતો.

સહાયીઓએ કહ્યું : અય અલ્લાહના રસૂલ(સ. અ. વ.) ! અમે આનાથી વધીને બીજો કોઈ ઈબાદતગુજરાત જોયો નથી !

રસૂલેખુદા(સ. અ. વ.)એ ફરમાવ્યું : તે શું કામ-કાજ (વ્યવસાય) ઘરાવે છે ?

ફરમાવ્યું : તે કોઈ કામ નથી કરતો !

આપ(સ. અ. વ.)એ ફરમાવ્યું : તેનો ખર્ચ કોણ પુરો પાડે છે ?

ફરમાવ્યું : અમે તેનો ખર્ચ ઉપાડી લઈએ છીએ.

આપ(સ. અ. વ.)એ ફરમાવ્યું : તમે તેનાથી મોટા ઈબાદતગુજરાત છો ! (શહેરિસાલતુલ હુક્ક, પેજ નં. ૫૨)

૭. કામ પ્રત્યે બદલાયેલું લોકવલાણ

થોડા વર્ષો પહેલાની સરખામણીએ વર્તમાન સમયમાં કામ પ્રત્યે લોકોનું વલણ બદલાયેલું જોવા મળે છે. જેના કારણે અનેક સમસ્યાઓ ઘર થઈ ગયેલી જોવા મળે છે.

નાનાંમોટાં શારીરિક શ્રમનાં કામ કરવામાં કોઈ શરમ કે સંકોચ ન રાખવો જોઈએ. શ્રમ કરનાર માણસ ક્રમનસીબ, ઉત્તરતી કોટિનો એવી વ્યાખ્યા આજના યુવાનોમાં પ્રચલિત બની ગઈ છે, અને એજ રીતે એશારામવાળું જીવન ગાળનાર વધુ સદ્ગુરી અને ઉચ્ચી કોટિનો એવું વલણ લોકોમાં જોવા મળે છે, જે બરાબર નથી.

પ્રાચીન સમાજવ્યવસ્થામાં ખેતી અને ગૃહઉધ્યોગોને ઘણું મહત્વ મળતું. આમાંથી સમૂહભાવના અને સ્વાવલંબન જેવા ગુણો કેળવાતા. પરંતુ આજનો યુવાન ટેબલ ખુરશીવાળી નોકરીને વધુ પસંદગી આપવા લાગ્યો છે. પશુપાલન, બાગાયત, બાગકામ, ખેતીકામ વગેરે કાર્યો શારીરિક શ્રમનાં છે, પરંતુ આ બધા કામો હવે ફક્ત ગમડાના અને અશિક્ષિત લોકોનો વ્યવસાય ગણાય છે. પરંતુ સત્ય હક્કિકત એ છે કે આ બધા વ્યવસાયો કરવાથી અંતરના ઉમંગ, ઉત્સાહ અને ખુશીમાં વધારો થાય છે. વાવેલાં બીજ અંકુરાય, મોટાં થાય અને તેના પર ધાન્યકણો બેસે અથવા ફૂલ, પાંદડાં, મંજરી બેસે કે ફળ આવે એ કુદરતની પ્રક્રિયા મનને સાત્વિક આનંદ આપે છે તેથી જ ખેતીને કારણો કરેલો શ્રમ મનને તંદુરસ્ત બનાવે છે, અને આનંદ આપે છે. ઈતિહાસ સાક્ષી છે કે નબીઓ અને ઈમામો પણ ખેતી અને બાગકામ જેવા સખત મહેનતના કાર્યો વિના સંકોચે કરતા હતા.

લાયકાત મુજબની નોકરી કે કામનું ન મળવું, શિક્ષિત(એજ્યુકેટર) હોવાના કારણે મહેનત – મજદુરીવાળા કામને પસંદગી ન આપવી, પ્રતિષ્ઠાને અનુરૂપ ધંધો / વ્યવસાય સેટ ન થવો કે પછી ઓછા સમયમાં વધારે કમાવી આપે તેવું અને મહેનત વગરનું સહેલું કામ મેળવવાની લાલચ વગેરે જેવા કારણોના લીધે યુવાનો પણ બેકારી અને નવરાશના ચક્કરમાં ફસાઈ જાય છે જે આગળ જતા તેમની કારકિર્દી અને તેમના દીન માટે ખુબ જ મોટો ખતરો બની જાય છે, જ્યારે કે ખરેખર તો ઉપરોક્ત દરેક પરિસ્થિતીમાં અલ્લાહ ઈન્સાનને ચકાસતો હોય છે અને તેના રીજિક બાબતે તેની કસોટી કરતો હોય છે કે તેનો બંદો આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ કુરઆન અને અહલુલબૈત(અ. મુ.)એ બતાવેલા રસ્તાને અનુસરે છે કે પછી સમયના પ્રવાહમાં તણાઈને પોતાના યુવાધનને વેડફી નાખે છે.

C. સ્ત્રીઓ અને આળસ

ધરકામ એ સ્ત્રીઓ માટે જેહાદનો દરજજો ઘરાવે છે. વળી, સ્ત્રીઓ અને બહેનોને ઘરની વ્યવસ્થા, સ્વચ્છતા, સુંદરતા અને સુધડતા માટે કરેલો પરિશ્રમ કંટાળાજનક લાગતો નથી. ખરા ઉમંગથી એ કામ થતું હોય છે. સ્વેચ્છાએ કરેલો પરિશ્રમ બધી રીતે પ્રસન્નતા આપે છે. પરંતુ વર્તમાન સમયમાં સ્ત્રીઓ અને બહેનોમાં ‘ઓદ્ધું કામ એજ સુખ’ એ સૂત્ર પ્રચલિત બની ગયુ હોવાથી અને કામવાળીનો રિવાજ પગપેસારો કરી રહ્યો હોવાથી, તેઓમાં નાના-મોટાં ઘરેલું રોગો અને નબળાઈઓમાં વધારો થયેલો જોવા મળે છે. આજ કારણ છે કે ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ શહેરની સ્ત્રીઓની સરખામણીએ વધુ તંદુરસ્ત અને ખંતીલી જોવા મળે છે.

સ્ત્રીઓ માંદલી, નિર્બળ અને અશક્ત જોવા મળે છે, તેના કેટલાક નીચે મુજબના કારણો પણ છે :

- સવારે વહેલાં ઉઠી આંગણાં વાળીજૂડીને સાફ કરતી સ્ત્રીઓ હવે મોડે સુધી પથારીને છોડવાનું નામ નથી દેતી.
- હાથે દળવાની ઘંટીનું સ્થાન હવે બજારમાંથી મળતા તૈયાર ઘંટના લોટે લઈ લીધું છે.
- ગાય-ભેંસ વગેરે પાલતુ પ્રાણીઓને પાળવાનો હવે રિવાજ નથી રહ્યો, તેથી દૂધ દોહવું, પ્રાણીઓની સ્વચ્છતા જાળવવી, તેમની ગંદકી સાફ કરવી વગેરે કાર્યો હવે અસ્તિત્વમાં નથી રહ્યા.
- કૂવા, વાવ, તળાવ કે નદીએથી પાણી લાવવાની હવે જરૂર નથી રહી.
- બળતણ માટે છાણાં લાવવા કે લાકડા વીણવા જવાની હવે સ્ત્રીઓને જરાય ચિંતા નથી.
- કુપડા ધોવા માટે વોશીગ મશીન હાજર છે.
- મકાનને કે આંગણાંને લીપણકામથી સંજાવવાની પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે.
- રસોઈ કરવામાં પણ હવે તો રવિવારે અને તહેવારોના દિવસોમાં રજા હોય છે, કારણે કે તૈયાર ફુડ અથવા તો હોટલમાં જમવા જવું એ સ્ટેટ્સ સિઝ્બોલ ગણાય છે.
- ઘરની સ્વચ્છતા અને સફાઈનો દારોમદાર હવે કામવાળી બહેનો ઉપર નિર્ભર છે.

૬. નિવૃત્ત જીવન (રીટાર્ડ લાઈફ)

ભારતીય સમાજમાં અને વિદેશમાં પણ નોકરીની સમયમયાદા પૂરી કર્યા પછી અથવા તો વેપાર-ધંધો સંતાનોને સોંપી દીઘા પછી નિવૃત્તિની (પ્રવૃત્તિ વિના બેસી રહેવાની) પ્રથા પ્રચલિત છે જે બિનઈસ્લામીક રિવાજ અને પ્રણાલી છે અને તેને ઈસ્લામ સાથે કાંઈ લેવા-દેવા નથી. એજ પ્રમાણે કેટલાક લોકો પોતાની બેઠી આવક / વ્યાજની હરામ આવક / પેન્શન ઉપર નિર્ભર રહી પોતાના જીવનનો મૃત્યુ સુધીનો મૂલ્યવાન અંતિમ તબકકો નવરાધૂપ બેસીને વેડફી નાખે છે અને અનેક પ્રકારના શારિરિક, માનસિક અને આર્થિક નુકસાનોને આમંત્રણ આપે છે. નિવૃતી દરમ્યાન નવરા બેસી રહેવાના કારણે સમયાંતરે માનસિક તાણ (ટેન્શન), આળસ, જાત-જતના વિચારો આવવા, ગુસ્સો, બિમારી, ઉધનું વધારે-ઓદ્ધ થવું, રોજંદા જીવનનું સમયપત્રક (શેડ્યુલ) વિખેરાઈ જવું વગેરે અનેક પ્રકારની સમસ્યાઓ તેમને ધેરી લે છે અને વધુમાં ધરે નવરા બેસી રહેવાથી ઘરના સભ્યોની ટીકા અને તેમના ચહેરાના પ્રતિકૂળ અને તંગ હાવભાવને પણ બરદાશ્ત કરવા પડે છે, પરિણામરૂપે નિવૃત વડીલો / વધોવૃધ્ય વ્યક્તિઓ ઘરમાં પોતાનું સ્વભાવન અને કયારેક સ્થાન પણ ગુમાવી બેસે છે.

ઈસ્લામે હંમેશા મહેનત કરી સ્વાવલંબી રહેવાનો અને બીજા ઉપર બોજરૂપ ન બનવાનો હુકમ આપેલ છે તેમજ નવરા / કામકાજ વગર બેસી રહેવાની સખત મનાઈ ફરમાવી છે. સીનિયર સીટીઝન્સ—વયોવૃદ્ધ મોઅમ્રીનો અને યુવાનોએ પણ આ બાબતને ધ્યાનમાં રાખી કોઈપણ સંજોગોમાં કામકાજ / વ્યવસાયને છોડી ન ઢેવો જોઈએ અને હંમેશા યથાશક્તિ મુજબ કામકાજમાં પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. ખરેખર ! ઈસ્લામના કોઈપણ હુકમનું પાલન અને તેણે મનાઈ કરેલા કામથી બચીને રહેવું એ ખુદ ઈન્સાનના પોતાના જ ભલા માટે હોય છે !